

ફીમેલ હેલ્થ વર્કર

તા: ૦૨-૦૮-૨૦૨૧, સોમવાર **સ્થળ:** સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટેરીયમ, સયાજીબાગ, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા ખાતે સામેલ યાદી મુજબના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.

સૂચનાઓ

- (૧) ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટ્સ આધારે કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાઓ અને પ્રતિક્ષા યાદીની વિગતો ધ્યાને લઈ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સાડ્ બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
- (૨) ઉમેદવાર, ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી તેઓનો પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.
- (૩) ઉમેદવારો દ્વારા રજૂ કરવાના પ્રમાણપત્રની યાદી
 - પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઈ.ડી. પ્રુફ
 - જન્મ તારીખના પુરાવા માટે:- શાળા છોડ્યાનો દાખલો અથવા જન્મ નો દાખલો
 - ધોરણ - ૧૦ અને ૧૨ ની માર્કશીટ, બોર્ડનું પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય.
 - શૈક્ષણિક લાયકાતમાં જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત પૈકી આપે ધારણ કરેલ શૈક્ષણિક લાયકાત ના છેલ્લા વર્ષ/ સેમેસ્ટરની માર્કશીટ અને બોર્ડ/ યુનિ. નું પ્રમાણપત્ર
 - અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો.
 - S.E.B.C. ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ નોન- કિમિલેયર પ્રમાણપત્ર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯/૨૦૧૯-૨૦/૨૦૨૦-૨૧ ની આવકના અધારે રાજ્ય સરકારની નોકરી માટે (પરિશિષ્ટ-૦૪ મુજબ ગુજરાતી નમુનામાં) કઢાવેલ સર્ટીફિકેટ તા.૦૧-૦૪-૨૦૧૯ થી તા.૦૮-૦૮-૨૦૨૦ દરમિયાન મેળવેલ હોય તેવું નોન- કિમિલેયર પ્રમાણપત્ર.
 - EWS ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા ઈસ્યુ થયેલ તા.૧૪-૦૧-૨૦૧૯ થી તા.૦૮-૦૮-૨૦૨૦ સુધીમાં મેળવેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 - PH ઉમેદવારો માટે PH તરીકેનું સા.વ.વિ. ના તા.૦૧-૧૨-૨૦૦૮ ના પરીપત્ર ફ્રાંક : ૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ-૨ થી નિયત થયેલ નમૂનામાં સરકારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનું પ્રમાણપત્ર.
 - ઉમેદવારોએ ઉપરોક્ત સૂચનાઓ ઉપરાંત કોવીડ-૧૯ અન્વયેની નીચે મુજબની સૂચનાઓ પણ ધ્યાને લેવાની રહેશે.
 - (૧) દરેક ઉમેદવારોએ મોં પર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
 - (૨) પ્રમાણપત્રો ચકાસણીના સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી/ઉમેદવાર સિવાય તેઓના સગા/સંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
 - (૩) કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્ર / રાજ્ય સરકારશ્રી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.